

ભરાઈ ગયેલી લાઈન અને સાધનો – માથાનો દુઃખાવો

સપ્ટેમ્બર - ૨૦૧૯

યુએસબી એ એક અક્સમાતનું પુષ્ટકરણ કરેલું જેમાં પ્રક્રિયામાં સમસ્યાને કારણે વેન્ટ ભરાઈ ગઈ (ચિત્ર-૧) અને કચરાની સર્જ ટાંકી ઉપર લગાવેલ રીલીફ પ્રણાલી પણ ભરાઈ ગઈ. જ્યારે મરમત કરનાર માણસ સર્જ ટેન્કને સાફ્ કરવા, તેને ખોલવા ગયો ત્યારે અંદર ગયેલા દબાણને કારણે ઉપરનું ભારે ફાંકણું દૂર તુટીને પડ્યું (ચિત્ર-૨) જેનાથી ત્યાં રહેલા ત્રણો વ્યક્તિતો મૃત્યુ પામ્યાં. આવું શા કારણો થયું ?

ટાંકી દબાણ નીચે હતી તો મરમત કરનાર માણસોએ ટાંકી ખોલી કેમ ? પ્રક્રિયાની શરૂઆત વખતે પ્રક્રિયામાંથી ઓછા માત્રાની પ્રોડક્ટ, સર્જ ટાંકીમાં મોકલવામાં આવી જેણો ગેસ છોડ્યો અને વેન્ટ ભરાઈ ગયેલી હોવાથી ટાંકીની અંદર દબાણ વધ્યું. પ્રેસર ગેજ (ઇન્ટીક્ટર) પણ ભરાઈ ગયો હોવાથી તેણે કોઈ દબાણ બતાવ્યું નહીં.



ચિત્ર-૧ ભરાઈ ગયેલી વેન્ટ લાઈન



ચિત્ર-૨ છુટુ પડેલું ફાંકણ

શું તમે જાણો છો ?

- ભરાઈ ગયેલી લાઈનો અને સાધનો માથાનો દુઃખાવો છે, તેની સુરક્ષિત રીતે સફાઈ કરવી એ ખૂબ હેરાનગતી વાળું કામ છે. ભરાઈ ગયેલ લાઈનો અને સાધનો કોઈ બીજા સાથે જોડાયેલા હોઈ શકે અને તે બીજા અહમ વિષય તરફ નિર્દેશ કરાવે છે. – જેમકે અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા રીલીફ પ્રણાલી ભરાઈ ગયેલ છે.
- ઘણી વસ્તુઓ ભરાઈ જવા માટે કારણભૂત હોય છે. ઉચા તાપમાને પીગળતાં પદાર્થો, પ્રક્રિયાના પ્રવાહમાં રહેલાં ઘન પદાર્થો અથવા કાટ ખાયેલ પ્રોડક્ટ પાઈપ. સાધનો ને ખોલવાનું ચાલુ કરતાં પહેલાં કે ભરાયેલા સાધનોને સાફ્ કરવા યોગ્ય આઈસોલેશનની જરૂર હોય છે. (લોટો-LOTO)
- લાઈનોને સાફ્ કરતાં પહેલાં લેવાના ચોકકસ પગલાંની યાદી અને પદ્ધતિ તૈયાર હોવી જોઈએ અથવા તો બનાવી જોઈએ.

તમે શું કરી શકો ?

- ભરાઈ ગયેલી લાઈનો અને સાધનો બીજી સમસ્યા તરફ અંગુલીનિર્દેશ કરાવે છે જેમકે પ્રક્રિયામાં ગરબડ, વધારે પડતો કાટ વિગેરે. નાનકડા ભરાવાને પણ તુરત જણાવો ભલે પછી તે પ્રક્રિયામાં નાનકડી સમસ્યા ઉત્પન્ન થવાને કારણ હોય.
- સમયાંતરે લાઈનો અથવા સાધનો ભરાઈ જાય તો તેની તપાસ કરવી જરૂરી છે જેથી ગરબડને દૂર કરી શકાય અને તેને સાફ્ કરવાની સમસ્યામાંથી પણ.
- લાઈનો અથવા સાધનોને સાફ્ કરતા પહેલાં તેનું પુષ્ટકરણ કરો કે કામ કેવી રીતે કરવામાં આવશે અને સાફ્ કરતી વખતે બીજા કયા જોખમો રહેલા છે.

જ્યારે સાધનો ભરાઈ જાય ત્યારે એ એક ચેતવણી છે કે બીજા સાધનો પણ ભરાઈ ગયા હશે !

©AIChE 2019. All rights reserved. Reproduction for non-commercial, educational purposes is encouraged. However, reproduction for any commercial purpose without express written consent of AIChE is strictly prohibited. Contact us at ccps_beacon@aiche.org or 646-495-1371.